



CHARTERED LOGISTICS LIMITED

CIN:L74140GJ1995PLCO26351

REG. OFFICE: B/501, STELLAR, OPP. ARISTA, SINDHUBHAVAN ROAD, AHMEDABAD-380059.

Website: www.chartered.co.in, Email:-cs@chartered.co.in, Tel:-079-26891752

Date: 11/11/2023

To
Department of Corporate Services,
BSE Limited
25th Floor, Phiroze Jeejeebhoy Towers,
Dalal Street,
Mumbai - 400 001.
BSE Code: 531977

Sub.: Compliance under Regulation 47 of SEBI (Listing Obligations and disclosure Requirements) Regulations, 2015

Dear Sir/Madam,

Pursuant to Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulation, 2015, please find the enclosed the extract of newspaper advertisements regarding the publication of Unaudited Financial Results for the quarter and half year ended on September 30, 2023 in the below mentioned newspapers:

- 1.The Indian Express
- 2.Financial Express

Please find above in order and take the same on your record.

Thanking You,

Yours Faithfully,

For Chartered Logistics Limited

HIRVITA
ROHAN SONI

Digitally signed by
HIRVITA ROHAN SONI
Date: 2023.11.11
14:16:37 +05'30'

HIRVITA SHAH
Company Secretary &
Compliance Officer
Membership No.:-A35230

- **Values** :-Honesty & Integrity, Commitment, Efficiency, Safety.
- **Vision** :-To be a premium logistics company with focus on better than the best.
- **Mission** :-To deliver delight to our Customers, Stakeholders and Employees.

WANTED
SADBHAVNA TRUST HOSPITAL
VADLI-KALSAR, Mahuva, Dist. Bhavnagar

Anaesthetist (M.D. or D.A.)

Both Units Require Full Time for Each Unit.
Qualified Doctor should
Contact Managing Trustee.

Mo. 99791 86856 / 96645 91778

King George's Medical University U.P., Lucknow.
e-mail: ececoekgmu@gmail.com

ONLINE APPLICATIONS ARE INVITED FOR THE POSTS OF JUNIOR RESIDENTS (NON P.G) & DEMONSTRATORS FOR THE SESSION 2023-2024.

FOR FURTHER DETAILS KINDLY VISIT THE UNIVERSITY WEBSITE www.kgmu.edu.in & www.kgmu.org **Controller of Examinations**

NOTICE
UNIT: KINTECH RENEWABLES LIMITED
REGD. OFFICE: Kintech House, 8, Shivaji Plaza, Opp. AMA IIM Road, Ahmedabad - 380 015, Gujarat, India

Notice is hereby given that the certificate(s) in respect of below mentioned Equity shares of the Company has / have been lost / misplaced / stolen and the holder(s) of the said shares has / have applied/applying to the company for issue of Duplicate share Certificate(s) in lieu of the original share certificate(s).

Sr. No.	Name of Shareholder(s)	Folio No.	No. of Shares	Certificate Nos.	Distinctive No.
1	MOHANBHAI BUDHABHAI DABHI	493	100	225 & 226	877651-877700 877701-877750

Any person, who has a claim in respect of the said shares, should lodge such claim with the Company at its Registered Office within 15 days from publication of this notice, failing which the Company will proceed to issue duplicate share certificate(s) without further intimation.
Place: Surat
Date: 10.11.23
Name of the Shareholder(s): Mohanbhai budhabhai Dabhi. Surat

PRINCIPAL REQUIRED
Shri J. M. Patel Arts and Smt. M.N. Patel Commerce Mahila College, Unjha managed by Shri Kanya Kelavani Mandal, Unjha has obtained permission from the Commissioner of Higher Education vide letter number KV7/ISC8/ Aa. Bharti / 2023 / 21606-607 dated 26/10/2023 to fill the vacant post of Principal.

QUALIFICATIONS: The applicant for the post of Principal must have

- Qualification specified in the UGC guidelines of 30th June 2010, 18th July 2018 and 24th May 2021 as well as in the resolutions of the Education Department published from time to time.
- A Master degree with at least 55% from a recognized university along with a Ph.D.
- Professor/Associate Professor with a total service/experience of at least fifteen years of teaching/research in Universities, Colleges and other institutions of higher education.
- A minimum of 10 research publications in peer-reviewed or UGC-listed journals.
- A minimum of 10 Research Score as per Appendix-2, Table-2 and the research score shall be from the minimum of three categories out of six categories.
- Salary shall be as per prevailing government and UGC guidelines.
- Employed candidates must attach the NOC of their institute.
- Applications with incomplete details and late applications will not be considered.
- candidate can refer the sample copy of the application and referential resolutions on the college website
- Candidates must send an application through registered AD post along with their bio-data, recent passport size photograph and self-attested copies of their UG/PG/Ph.D./Research certificates/API score and attested of publication of their experience certificate to the below address within 15 days of publication of this advertise

ADDRESS SECRETARY SHRI KANYA KELVANI MANDAL, SARDAR CHOKI, DIST. MEHSANA, UNJHA.-384170

PUBLIC NOTICE
The non-agricultural land situated at Mouje - Shela village of Taluka and Sub-District - Sanad of Registration District - Ahmedabad bearing Block No. 364/B1 admeasuring 6628 Sq. Mtr. is in ownership and occupancy of Rashmi Bluvian Infracon partnership firm without any encumbrance and original old documents of the said land such as (1) sale deed no.4343 dated 29.06.2011 (2) sale deed no. 12918 dated 25.11.2019 (3) sale deed no.10154 dated 04.12.2020 and (4) sale deed no.2766 dated 22.02.2021 has been lost by employee of the said partnership firm on 02.08.2023 and those have not been recovered despite having searched for the same and I have been informed that till today those documents have not been kept before any person, bank, firm or institute against mortgage, lien or security and with that regard, they have asked me for necessary certificate. Therefore, I am writing this notice to inform the public that if any person, bank, firm or institute, etc. has any right, title, interest or encumbrance in the said land, then they shall inform in writing and produce such claim along with relevant evidences and documents within 7 days from the date of publication of this notice to the below mentioned address by registered post A.D. (objections without evidences shall not be considered), failing which none shall be liable to claim any right, title, interest or encumbrance on the said land and if anybody has, then it shall be considered that that person has waived his/her right, title, interest or encumbrance from the said land and thereafter, no objection certificate shall be issued and no dispute to that effect shall be tenable.
Date: 09.11.2023
Under instructions of; Harshalbhai Dipakbhai Hirpara, On behalf of Rashmi Bluvian Infracon partnership firm.
MANOJ K. SINDHAV, Advocate
301-302, Elite, Opp. Sapath Hexa, Nr. Sola Overbridge, S.G. Highway, Sola, Ahmedabad - 380060.

PUBLIC NOTICE
Notice is hereby given that we are investigating the rights, title and interests of Neptune Infratech Private Limited ("Landowner"), on all that piece and parcel of land being revenue Survey/Block No. 228 admeasuring about 1,54,291 square meters (one lakh fifty four thousand two hundred and ninety one) (erstwhile land revenue survey No. 359/paik/2) comprising of (i) Plot No. A-1 admeasuring about 3,560 square meters; (ii) Plot No. A-2 admeasuring about 4,800 square meters; (iii) Plot No. A-3 admeasuring about 4,475 square meters; (iv) Plot No. A-4 admeasuring about 4,475 square meters; (v) Plot No. A-5 admeasuring about 6,210 square meters; (vi) Plot No. A-6 admeasuring about 5,000 square meters; (vii) Plot No. A-7 admeasuring about 5,220 square meters; (viii) Plot No. A-8 admeasuring about 4,905 square meters; (ix) Plot No. A-9 admeasuring about 4,535 square meters; (x) Plot No. A-10 admeasuring about 4,860 square meters; (xi) Plot No. A-11 admeasuring about 4,300 square meters; (xii) Plot No. A-12 admeasuring about 5,295 square meters; (xiii) Plot No. A-13 admeasuring about 5,745 square meters; (xiv) Plot No. A-14 admeasuring about 4,360 square meters; (xv) Plot No. A-15 admeasuring about 1,750 square meters; (xvi) Plot No. A-16 admeasuring about 1,750 square meters; (xvii) Plot No. A-17 admeasuring about 4,370 square meters; (xviii) Plot No. A-18 admeasuring about 4,460 square meters; (xix) Plot No. A-19 admeasuring about 4,315 square meters; (xx) Plot No. A-20 admeasuring about 4,375 square meters; (xxi) Plot No. A-21 admeasuring about 3,000 square meters; (xxii) Plot No. A-22 admeasuring about 4,915 square meters; (xxiii) Plot No. A-23 admeasuring about 4,155 square meters; (xxiv) Plot No. A-24 admeasuring about 3,045 square meters; (xxv) Plot No. A-25 admeasuring about 3,392 square meters; (xxvi) Plot No. A-26 admeasuring about 3,420 square meters; (xxvii) Plot No. A-27 admeasuring about 3,055 square meters totally admeasuring about 1,16,292 square meters together with open parking spaces and internal roads admeasuring about 37,999 square meters situated within the limits of Village: Martoli, Taluka: Jotana, District: Mehsana (hereinafter referred to as the said "Property").

Any persons having or claiming any estate, right, title, share, interest or demand of any nature whatsoever to or in respect of the rights, title and/or interest of the Landowner (as the case may be) on the said Property or any part thereof, whether by way of sale, transfer, agreement to transfer (including by way of sale or assignment or lease), interest, mortgage, exchange, lease, sub-lease, charge, easement, right of way, claims, disputes, assignment, lien, tenancy, sub-tenancy, trust, license, gift, inheritance, covenant, maintenance, bequest, encumbrance, FSI/ TDR consumption, development rights, possession, lis pendens, or otherwise of any nature whatsoever, are required to make the same known in writing along with relevant documentary proof in that regard to the undersigned within 10 (ten) days from the date of publication of this notice through Registered AD Post, failing which, any such right or claim shall be disregarded and shall be deemed to have been waived and it shall be presumed that the right, title and interests of the Landowner to the said Property are clean, clear, marketable and free from all encumbrance(s) of any nature whatsoever and no other person has any right, title or interest of any nature whatsoever in the title of the Landowner on the said Property or any part thereof.
Date: November 11, 2023
For Cyril Amarchand Mangaldas, Mudit Shah, Partner
Block A - 1512, 15th Floor, Navratna Corporate Park, Ambli Bopal Road, Bodakdev, A'bad-380058.
Phone: 079 - 35039999

LAST MILE ENTERPRISES LIMITED
(Formerly known as Trans Financial Resources Limited)
4th Floor Vaghela Avenue, Nr. Havmore Restaurant, Navrangpura, Ahmedabad-380009, Gujarat.
E-MAIL: trf4444@gmail.com • CIN:L0100GJ1994PLC022954

EXTRACT FROM THE STANDALONE AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED ON 30.09.2023

Sr. no	Particulars	(Rs. In Lakhs)			
		Quarter ended on 30-09-2023 Unaudited	For the year quarter on 30-09-2022 Unaudited	Half year ended on 30-09-2023 Unaudited	Year ended 31-03-2023 Audited
1	Total income from operations	0.00	1604.11	14.04	5319.69
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	-17.78	1600.41	-82.88	707.57
3	Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary items)	-17.78	1600.41	-82.88	707.57
4	Net Profit / (Loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary items)	-17.78	1196.94	-82.88	457.57
5	Total Comprehensive Income for the period (Comprising Profit/ (loss) for the period (after tax) and other Comprehensive Income (after tax))	-17.78	1196.94	-82.88	457.57
6	Equity Share Capital	1317.08	1168.58	1317.08	1168.58
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of Previous Year	-	-	-	129.76
8	Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations)				
	Basic :	-0.13	10.24	-0.63	3.92
	Diluted :	-0.13	10.24	-0.63	3.92

Notes:
1. The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchange under Regulation 33 of SEBI (Listing and Other Disclosure Requirements) Regulation, 2015. The full Format of the financial Results are available on the Stock Exchange website (www.bseindia.com) and on the Company website (www.transfinancialrtd.com)
2. The result of the Quarter ended on 30st September, 2023 were reviewed by the Audit Committee and approved by the Board of Director at its meeting held on 10th November 2023.

BY ORDER OF THE BOARD OF DIRECTORS, FOR, LAST MILE ENTERPRISES LIMITED
FORMERLY KNOWN AS TRANS FINANCIAL RESOURCES LIMITED
Mr. Harishkumar Bhalchandra Rajput
(Managing Director)
(DIN : 06970075)

Place : Ahmedabad
Date: 10/11/2023

SHASHIJIT INFRAPROJECTS LIMITED
CIN: L45201GJ2007PLC052114
Registered Office: Plot No. 209, Shop No. 23, 2nd Floor, Ginnar Khushboo Plaza, GIDC, Vapi-396195, Gujarat, India. Tel. No. 0260-2432963
W: www.shashijitinfraprojects.com E: info@shashijitinfraprojects.com

UN-AUDITED STANDALONE FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED SEPTEMBER 30, 2023
(Amount in Lakhs, except EPS)

Sr. No.	Particulars	Quarter ended 30.09.2023	Corresponding Quarter ended 30.09.2022	Year to date ended 30.09.2023	Year ended 31.03.2023
		Unaudited	Unaudited	Unaudited	Audited
01.	Total Income from Operations (net)	618.233	808.655	1431.326	3534.012
02.	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	19.057	1.748	46.436	68.016
03.	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	19.057	1.748	46.436	68.016
04.	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	10.626	4.974	33.158	45.074
05.	Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	11.227	5.285	34.211	47.197
06.	Equity Share Capital(Face value of Rs. 10/-)	1034.40	1034.40	1034.40	1034.40
07.	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year				146.317
08.	Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations) -				
	1. Basic:	0.10	0.05	0.32	0.44
	2. Diluted:	0.10	0.05	0.32	0.44

Notes:
The above is an extracts of the detailed format of Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (LODR) Regulations, 2015. The said result has been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their meeting held on 10th November, 2023. The full format of the Quarterly and half yearly Financial Results are available on the websites of the Stock Exchange, i.e. www.bseindia.com and on the Company's website www.shashijitinfraprojects.com.

For and on behalf of the Board of SHASHIJIT INFRAPROJECTS LIMITED
Sd/-
Ajit Jain
Chairman & Managing Director

Date: 11th November, 2023
Place: Vapi

Government of India
Ministry of Social Justice and Empowerment
Department of Empowerment of Persons with Disabilities (Divyangjan) 5th Floor, Pt. Deendayal Antyodaya Bhawan, CGO Complex, Lodhi Road, New Delhi-110003

Scholarship for Students with Disabilities (Divyangjan) for the year 2023-24

Department of Empowerment of Persons with Disabilities provides an opportunity to Students with Disabilities (Divyangjan) for availing scholarship under the schemes viz. Pre-matric, Post-matric, Top Class Education and National Overseas Scholarship for the year 2023-24.

2. Instructions for applicants:

- Applicants are advised to apply online for Pre-Matric, Post Matric and Top Class Education Schemes on the website of National Scholarship Portal at www.scholarships.gov.in (a link to the site is also available at www.depwd.gov.in) or Mobile App of National Scholarship Portal. Applications for National Overseas Scholarship scheme are received offline.
- Details of the schemes including eligibility criteria and instructions for filling up the applications are available at www.depwd.gov.in.
- Applicants are advised to provide correct information while applying for scholarships.

3. Timeline for application:

- Applications for National Overseas Scholarship are received offline throughout the year.
- National Scholarship Portal is open for students' registration for applying for the scholarship schemes as per details below:

	Pre-Matric Scholarship	Post-Matric Scholarship	Top Class Scholarship
Last date for submission of online applications on National Scholarship Portal for Fresh scholarship (first time applicants) and renewal scholarship (applicants who got scholarships in the year 2023-24)	30.11.2023	31.12.2023	

Notes: Slots for Pre-Matric, Post-Matric and Top Class schemes include fresh as well as renewal cases. Fresh cases will be considered only against the left over slots after processing all the renewal cases. Thus, mere fulfilling the eligibility criteria will not entitle grant of scholarship due to fixed number of slots in a year.

4. Eligibility criteria:

- Scholarships are open for Nationals of India.
- A person with benchmark disability i.e. having not less than 40% disability, and having a disability certificate issued by the competent medical authority.
- Scholarship for studying in any class will be available for only one year. If a student has to repeat a class, he/she would not get scholarship for a second (or a subsequent) year.
- A scholarship holder under this scheme will not avail any other scholarship/stipend. No scholarship will be paid to the students under this scheme from the date he/she accepts any other scholarship/stipend
- Unique Disability Identity (UDID) or UDID enrolment number along with Disability Certificate is mandatory for availing benefits under any of the Scholarship schemes.
- Applicants may have to undergo Aadhaar based biometric authentication to avail the Scholarship
- For National Overseas, Applicant must have Fifty five per cent (55%) marks or equivalent grade in relevant Master's Degree or Bachelor's Degree.

CBC-38117/12/0039/2324

"IMPORTANT"

Whilst care is taken prior to acceptance of advertising copy, it is not possible to verify its contents. The Indian Express (P) Limited cannot be held responsible for such contents, nor for any loss or damage incurred as a result of transactions with companies, associations or individuals advertising in its newspapers or Publications. We therefore recommend that readers make necessary inquiries before sending any monies or entering into any agreements with advertisers or otherwise acting on an advertisement in any manner whatsoever.

વડોદરા ગેસ લિમિટેડ
(ગેઝલ ગેસ લિમિટેડ અને વડોદરા મહાનગર પાલિકાની સંયુક્ત કંપની)

જાહેર સૂચના
વિષય: ગેસ લીકેજ થી ગંધ આવવી અને તેની માહિતી આપવા બાબત.

વડોદરા ગેસ લિમિટેડ ના માનવના ગેસ ટ્રાકોને જવાબવાનું કે વડોદરા ગેસ લિમિટેડ દ્વારા પુરો પાડવામાં આવતા ગેસ પુરવઠામાં સંયુક્ત પ્રવૃત્તિ કરી પાઇપલાઇન ગેસ તથા સી.એન.કે. પુરો પાડવામાં આવે છે. જો કોઈ પરિસ્થિતિમાં શહેરના નાગરિકોને સહેલાઈ થઈ જેવી નીચ ગંધ ગ્રોઇ રહેવામાં/કેમરાઈઝ/સી.એન.કે. ગાડી/એલ.સી.વી કાર્સમાંથી આવતી જલાય તો તાત્કાલિક વડોદરા ગેસ લિમિટેડના નીચે જલાયેલ 24x7 કાર્યરત કોલે રૂમાં સંપર્ક કરવા વિનંતી છે. સંપર્ક ક્રમથી વડોદરા ગેસ લિમિટેડની ટીમ સરે હુસિદા ને તાત્કાલિક અસરથી ઓફ કરી મોકલ કરશે. ઉપરોક્ત બાબતે આપનો સાચ સહકાર આપવા વિનંતી છે. જેથી કોઈ દુર્ઘટના/અકસ્માત/આગ (નાગવાના બનાવો ને ટાળી શકાય. વધારાની કોઈ પણ પ્રકાર ની જાણકારી માટે આપેલ ટેલી.નં. ૧૮૦૦૨૩૩૬૦૪૮, ૦૨૬૫-૨૩૪૪૬૪૮/૨૫૦૮૦૬૧૦ ઉપર સંપર્ક કરવો સહવા VGL website <https://www.vgl.co.in> ઉપર આપેલ સરે વિસ્તાર બ ઈજનેર ને ફોન કરી માહિતી મેળવી શકાય.

કુડમ થી,
વડોદરા ગેસ લિ. દ્વારા પ્રકાશિત

RIVER FRONT HOTELS LIMITED
CIN : L55100GJ1991PLC016766
Regd. Office: Land Mark, Opp. Dutch Garden, Nanpura, Surat-395001, Gujarat. Contact No.: +91-9898000486, Email id: info@riverfronthotellimited.com, Website: www.riverfronthotellimited.com

EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED 30th September, 2023
(See Regulation 47(1) (b) of the SEBI (LODR) Regulations, 2015) (Amount in Rs.)

Sr No.	Particulars	3 Months Ended		Year Ended 31/03/2023 (Audited)
		30/09/2023 (Un-Audited)	31/03/2023 (Audited)	
1	Total Income from Operations	7.31	7.10	6.65
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	0.18	(9.25)	0.34
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	0.18	(9.25)	0.34
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	0.18	(9.25)	0.34
5	Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	0.18	(9.25)	0.34
6	Equity Share Capital	30.07	30.07	30.07
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-	-	-
8	Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations) -			
	1. Basic:	0.0059	(0.3079)	0.0113
	2. Diluted:			(0.2768)

Notes:
1. The above is an extract of the detailed format of Unaudited Financial Results filed with Stock Exchange under Regulation 33 of SEBI (Listing and Disclosure Requirements) Regulations, 2015. The full format of the results for the quarter and half year ended on 30th September, 2023 is available on Company's website at www.riverfronthotellimited.com and also on the website of Stock Exchange at www.mse.in.
2. The above results have been reviewed by the audit committee and approved by the board of the company at their meeting held on 09th November, 2023. The Statutory Auditor of the Company has carried out Audit of the financial results for the quarter and half year ended 30th September, 2023.

Date : 09th November, 2023
Place : Surat
For RIVER FRONT HOTELS LIMITED
sd/- (Farukh V. Poonawala) Managing Director

CHARTERED LOGISTICS LIMITED
CIN:L74140GJ1995PLC026351
REGD.OFF.: B-501, STELLAR, OPP. ARISTA, SINDHU BHAVAN ROAD, AHMEDABAD-380059.
Tel.: 079-26891752; E-mail: cs@chartered.co.in, Website: www.chartered.co.in

EXTRACTS OF STATEMENT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED SEPTEMBER 30, 2023
(₹ In Lakhs)

Sr. No.	Particulars	Quarter ended 30/09/2023	Quarter ended 30/09/2022	Half Year ended 30/09/2023	Year Ended 31/03/2023
		Unaudited	Unaudited	Unaudited	Audited
1	Total Income from operations (net)/Revenue	1724.65	1968.56	3644.76	8680.25
2	Net Profit / (Loss) for the period (before tax, exceptional and/or extraordinary items)	-8.20	-75.35	-30.58	-44.91
3	Net Profit / (Loss) for the period before tax (after exceptional and/or extraordinary items)	-8.20	-75.35	-30.58	-44.91
4	Net Profit / (Loss) for the period after tax (after exceptional and/or extraordinary items)	-8.20	-75.35	-30.58	-44.91
5	Total Comprehensive Income (Comprising profit/ (loss) after tax and Other Comprehensive Income after tax)	-8.20	-75.35	-30.58	-44.91
6	Equity Share Capital	993.40	993.40	993.40	993.40
7	Reserve (excluding revaluation Reserve) as shown in the Audited balance sheet of the previous year	-	-	-	-
8	Earnings Per Share (of Re. 1/-each) (not annualised)				
	a. Basic:	-0.01	-0.08	-0.03	0.02
	b. Diluted:	-0.01	-0.08	-0.03	0.02

Notes: 1. The above is an extract of the detailed format of unaudited financial results for the quarter and half year ended September 30, 2023 filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the same are available on the BSE Ltd website (www.bseindia.com) and Company's website (www.hipoln.com).
2. The above standalone unaudited financial results of the Company for the quarter and half year ended September 30, 2023 have been reviewed by an Audit Committee at its meeting held on November 10, 2023 and approved by the Board of Directors at their Meeting held on the same day. 3. Figures have been regrouped wherever necessary.

For and on behalf of the Board of Directors,
For Chartered Logistics Limited,
Lalit Kumar Gandhi
Managing Director (DIN :00618427)

Place : Ahmedabad
Date : November 10, 2023

PG Foils Ltd.
Regd. Office: 6, Neptune Tower, Ashram Road, Ahmedabad-380 009 (Gujarat)
Website: pgfoils.in, CIN: L27203GJ1979PLC008050

STATEMENT OF UNAUDITED RESULTS FOR THE QUARTER ENDED SEPTEMBER 30, 2023
(RS. IN LAKHS)

PART I Particulars (Refer Notes Below)	QUARTER ENDED		HALF YEAR ENDED		YEAR ENDED 31.03.2023
	30.09.2023 (Unaudited)	30.06.2023 (unaudited)	30.09.2023 (Unaudited)	30.05.2023 (Unaudited)	
1 Income From Operations					
a) Income from Operations	6035.71	8376.03	7118.75	14411.74	19289.79
b) Other Income	726.66	1307.94	665.54	2034.60	1335.77
Total Income From operations (net)	6762.37	9683.97	7784.29	16446.34	20625.56
2 Expenses					
a) Cost of Materials consumed	6158.72	6270.53	6554.79	12429.25	14679.34
b) Purchases of Traded Goods	180.02	1395.70	563.17	1575.72	1715.83
c) Changes in inventories of Finished Goods, Work in Progress and Stock in Trade	-826.46	342.13	-1504.05	-484.33	-87.66
d) Employee benefits expenses	459.16	446.59	557.20	905.75	902.70
e) Finance Costs	114.14	130.42	233.04	244.56	366.32
f) Depreciation and amortisation expenses	100.00	100.00	100.00	200.00	200.00
g) Other Expenses	438.23	373.72	526.73	811.95	917.21
Total Expenses	6623.81	9059.09	7030.88	15682.90	18693.74
3 Profit / (Loss) from operations before exceptional items (1-2)	138.56	624.88	753.41	763.44	1931.82
4 Exceptional Items	0.00	0.00	0.00	0.00	0.00
5 Profit / (Loss) before tax	138.56	624.88	753.41	763.44	1931.82
6 Tax Expenses					
a) Current tax	10.00	10.00	115.00		

Sr. No.	Particulars	Quarter ended	Quarter ended	Half Year ended	Year Ended
		30/09/2023	30/09/2022	30/09/2023	31/03/2023
		Unaudited	Unaudited	Unaudited	Audited
1	Total income from operations (net)/Revenue	1724.65	1968.56	3644.76	8680.25
2	Net Profit / (Loss) for the period (before tax, exceptional and/or extraordinary items)	-8.20	-75.35	-30.58	-44.91
3	Net Profit / (Loss) for the period before tax (after exceptional and/or extraordinary items)	-8.20	-75.35	-30.58	-44.91
4	Net Profit / (Loss) for the period after tax (after exceptional and/or extraordinary items)	-8.20	-75.35	-30.58	15.73
5	Total Comprehensive Income (Comprising profit/ (loss) after tax and Other Comprehensive Income after tax)	-8.20	-75.35	-30.58	15.73
6	Equity Share Capital	993.40	993.40	993.40	993.40
7	Reserve (excluding revaluation Reserve) as shown in the Audited balance sheet of the previous year	-	-	-	-
8	Earnings Per Share (of Rs. 1/-each) (not annualised)	-	-	-	-
a.	Basic:	-0.01	-0.08	-0.03	0.02
b.	Diluted:	-0.01	-0.08	-0.03	0.02

Note: 1. The above is an extract of the detailed format of unaudited financial results for the quarter and half year ended September 30, 2023 filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the same are available on the BSE Ltd website (www.bseindia.com) and Company's website (www.hipolinc.com).
2. The above standalone unaudited financial results of the Company for the quarter and half year ended September 30, 2023 have been reviewed by an Audit Committee at its meeting held on November 10, 2023 and approved by the Board of Directors at their Meeting held on the same day. 3. Figures have been regrouped wherever necessary.

For and on behalf of the Board of Directors,
For Chartered Logistics Limited,
Lalit Kumar Gandhi
Managing Director (DIN : 00618427)

Place : Ahmedabad
Date : November 10, 2023

Sr. No.	Particulars	Quarter ended	Quarter ended	Half Year ended
		30.09.2023	30.09.2022	30.09.2023
		Unaudited	Unaudited	Unaudited
1	Total Income From Operations (net)	0.00	0.00	0.00
2	Net Profit/(Loss) for ordinary activities (before Tax, Exceptional and/or Extraordinary Items)	(4.09)	(0.24)	(4.62)
3	Net Profit/(Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	(4.09)	(0.24)	(4.62)
4	Net Profit/(Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	(4.09)	(0.24)	(4.62)
5	Total Comprehensive Income for the Period (Comprising Profit/(Loss) for the period (After Tax) and Other Comprehensive Income (After Tax))	(4.09)	(0.24)	(4.62)
6	Equity Share Capital, (face value of Rs.10 each)	1000.00	1000.00	1000.00
7	Reserves (excluding Revaluation Reserve) as shown in balance Sheet of previous year	-	-	-
8	Earning Per Share (of Rs.10/- each) (For continuing and discontinued operations)			
	Basic	(0.041)	(0.002)	(0.046)
	Diluted	(0.041)	(0.002)	(0.046)

Note: 1. The above is an extract of the detailed Unaudited Financial Results ("Results") filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015. The full Financial Results are available on website of Stock Exchanges (i.e. www.bseindia.com) and website of the Company (i.e. www.mangalyasofttech.in).
2. The above results were reviewed by the Audit Committee and thereafter approved by the Board of Directors at their meeting held on November 10, 2023.

For, Mangalya Soft-Tech Limited
Ajay Janyantil Shah
Chairman & Managing Director
DIN: 00023582

Date: 10/11/2023
Place: Ahmedabad

Sr. No.	Particulars	Quarter ended	Quarter ended	Half Year ended
		30.09.2023	30.09.2022	30.09.2023
		Unaudited	Unaudited	Unaudited
1	Total Income From Operations (net)	0.00	0.00	0.00
2	Net Profit/(Loss) for ordinary activities (before Tax, Exceptional and/or Extraordinary Items)	(4.09)	(0.24)	(4.62)
3	Net Profit/(Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	(4.09)	(0.24)	(4.62)
4	Net Profit/(Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	(4.09)	(0.24)	(4.62)
5	Total Comprehensive Income for the Period (Comprising Profit/(Loss) for the period (After Tax) and Other Comprehensive Income (After Tax))	(4.09)	(0.24)	(4.62)
6	Equity Share Capital, (face value of Rs.10 each)	1000.00	1000.00	1000.00
7	Reserves (excluding Revaluation Reserve) as shown in balance Sheet of previous year	-	-	-
8	Earning Per Share (of Rs.10/- each) (For continuing and discontinued operations)			
	Basic	(0.041)	(0.002)	(0.046)
	Diluted	(0.041)	(0.002)	(0.046)

Note: 1. The above is an extract of the detailed Unaudited Financial Results ("Results") filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015. The full Financial Results are available on website of Stock Exchanges (i.e. www.bseindia.com) and website of the Company (i.e. www.mangalyasofttech.in).
2. The above results were reviewed by the Audit Committee and thereafter approved by the Board of Directors at their meeting held on November 10, 2023.

For, Mangalya Soft-Tech Limited
Ajay Janyantil Shah
Chairman & Managing Director
DIN: 00023582

Date: 10/11/2023
Place: Ahmedabad

Sr. No.	Particulars	Quarter ended	Quarter ended	Half Year ended
		30.09.2023	30.09.2022	30.09.2023
		Unaudited	Unaudited	Unaudited
1	Total Income From Operations (net)	0.00	0.00	0.00
2	Net Profit/(Loss) for ordinary activities (before Tax, Exceptional and/or Extraordinary Items)	(4.09)	(0.24)	(4.62)
3	Net Profit/(Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	(4.09)	(0.24)	(4.62)
4	Net Profit/(Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	(4.09)	(0.24)	(4.62)
5	Total Comprehensive Income for the Period (Comprising Profit/(Loss) for the period (After Tax) and Other Comprehensive Income (After Tax))	(4.09)	(0.24)	(4.62)
6	Equity Share Capital, (face value of Rs.10 each)	1000.00	1000.00	1000.00
7	Reserves (excluding Revaluation Reserve) as shown in balance Sheet of previous year	-	-	-
8	Earning Per Share (of Rs.10/- each) (For continuing and discontinued operations)			
	Basic	(0.041)	(0.002)	(0.046)
	Diluted	(0.041)	(0.002)	(0.046)

Note: 1. The above is an extract of the detailed Unaudited Financial Results ("Results") filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015. The full Financial Results are available on website of Stock Exchanges (i.e. www.bseindia.com) and website of the Company (i.e. www.mangalyasofttech.in).
2. The above results were reviewed by the Audit Committee and thereafter approved by the Board of Directors at their meeting held on November 10, 2023.

For, Mangalya Soft-Tech Limited
Ajay Janyantil Shah
Chairman & Managing Director
DIN: 00023582

Date: 10/11/2023
Place: Ahmedabad

Sr. No.	Particulars	Quarter ended	Quarter ended	Half Year ended	Year Ended
		30/09/2023	30/09/2022	30/09/2023	31/03/2023
		Unaudited	Unaudited	Unaudited	Audited
1	Total income from operations (net)/Revenue	1724.65	1968.56	3644.76	8680.25
2	Net Profit / (Loss) for the period (before tax, exceptional and/or extraordinary items)	-8.20	-75.35	-30.58	-44.91
3	Net Profit / (Loss) for the period before tax (after exceptional and/or extraordinary items)	-8.20	-75.35	-30.58	-44.91
4	Net Profit / (Loss) for the period after tax (after exceptional and/or extraordinary items)	-8.20	-75.35	-30.58	15.73
5	Total Comprehensive Income (Comprising profit/ (loss) after tax and Other Comprehensive Income after tax)	-8.20	-75.35	-30.58	15.73
6	Equity Share Capital	993.40	993.40	993.40	993.40
7	Reserve (excluding revaluation Reserve) as shown in the Audited balance sheet of the previous year	-	-	-	-
8	Earnings Per Share (of Rs. 1/-each) (not annualised)	-	-	-	-
a.	Basic:	-0.01	-0.08	-0.03	0.02
b.	Diluted:	-0.01	-0.08	-0.03	0.02

Note: 1. The above is an extract of the detailed format of unaudited financial results for the quarter and half year ended September 30, 2023 filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the same are available on the BSE Ltd website (www.bseindia.com) and Company's website (www.hipolinc.com).
2. The above standalone unaudited financial results of the Company for the quarter and half year ended September 30, 2023 have been reviewed by an Audit Committee at its meeting held on November 10, 2023 and approved by the Board of Directors at their Meeting held on the same day. 3. Figures have been regrouped wherever necessary.

For and on behalf of the Board of Directors,
For Chartered Logistics Limited,
Lalit Kumar Gandhi
Managing Director (DIN : 00618427)

Place : Ahmedabad
Date : November 10, 2023

S. No.	Particulars	Standalone					Consolidated				
		Quarter ended		Half Yearly		Year ended	Quarter ended		Half Yearly		Year ended
		September 30, 2023	September 30, 2022	September 30, 2023	September 30, 2022	March 31, 2023	September 30, 2023	September 30, 2022	September 30, 2023	September 30, 2022	March 31, 2023
		Unaudited	Unaudited (Restated)	Unaudited	Unaudited (Restated)	Audited (Restated)	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Audited
1	Total Income from operations	277.36	284.98	716.83	858.49	2,636.21	394.22	474.70	1,533.06	1,690.72	6,432.35
2	Profit/(loss) before exceptional items and tax	(177.67)	(68.63)	(153.09)	52.22	254.87	(634.79)	(442.37)	(608.24)	(331.81)	620.39
3	Profit/(loss) before tax	(177.67)	(170.25)	(153.09)	(49.40)	102.03	(634.79)	(286.09)	(608.24)	(175.53)	776.67
4	Profit/(loss) for the period/year (after tax)	(52.01)	(147.75)	(19.84)	(56.68)	42.45	(417.97)	(198.50)	(407.18)	(136.20)	575.92
5	Total comprehensive income for the period/year (comprising profit/(loss) and other comprehensive income for the period/year)	(55.55)	(149.27)	(23.43)	(58.66)	30.39	(424.58)	(201.10)	(411.13)	(137.14)	554.75
6	Equity Share capital	176.09	175.22	176.09	175.22	175.78	176.09	175.22	176.09	175.22	175.78
7	Reserves and surplus (excluding Revaluation Reserves)	NA	NA	NA	NA	8,313.72	NA	NA	NA	NA	8,780.38
8	Earnings/(loss) per share (in ₹)										
	- Basic	(1.48)	(4.22)	(0.56)	(1.62)	1.21	(11.45)	(5.66)	(10.71)	(3.89)	16.42
	- Diluted	(1.48)	(4.22)	(0.56)	(1.62)	1.21	(11.45)	(5.66)	(10.71)	(3.89)	16.40

Notes: 1. The above is an extract of detailed format of Quarterly and Half Yearly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of The SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly and Half Yearly Financial Results are available on the company's website www.schandgroup.com and on the website of BSE Limited (www.bseindia.com) and The National Stock Exchange of India Ltd. (www.nseindia.com).
2. The unaudited standalone and consolidated financial results for the quarter and half year ended September 30, 2023 were reviewed by the Audit Committee at its meeting held on November 10, 2023 and have been approved and taken on record by the Board of Directors at its meeting held on November 10, 2023.

For and on behalf of the Board of Directors
S Chand And Company Limited
s/-
Himanshu Gupta
Managing Director
DIN: 00054015

Date: November 10, 2023
Place: New Delhi

S. No.	Particulars	Quarter ended	Quarter ended	Half Year ended
		30.09.2023	30.09.2022	30.09.2023
		Unaudited	Unaudited	Unaudited
1	Total Income From Operations (net)	0.00	0.00	0.00
2	Net Profit/(Loss) for ordinary activities (before Tax, Exceptional and/or Extraordinary Items)	(4.09)	(0.24)	(4.62)
3	Net Profit/(Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	(4.09)	(0.24)	(4.62)
4	Net Profit/(Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	(4.09)	(0.24)	(4.62)
5	Total Comprehensive Income for the Period (Comprising Profit/(Loss) for the period (After Tax) and Other Comprehensive Income (After Tax))	(4.09)	(0.24)	(4.62)
6	Equity Share Capital, (face value of Rs.10 each)	1000.00	1000.00	1000.00
7	Reserves (excluding Revaluation Reserve) as shown in balance Sheet of previous year	-	-	-
8	Earning Per Share (of Rs.10/- each) (For continuing and discontinued operations)			
	Basic	(0.041)	(0.002)	(0.046)
	Diluted	(0.041)	(0.002)	(0.046)

Note: 1. The above is an extract of the detailed Unaudited Financial Results ("Results") filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015. The full Financial Results are available on website of Stock Exchanges (i.e. www.bseindia.com) and website of the Company (i.e. www.mangalyasofttech.in).
2. The above results were reviewed by the Audit Committee and thereafter approved by the Board of Directors at their meeting held on November 10, 2023.

For, Mangalya Soft-Tech Limited
Ajay Janyantil Shah
Chairman & Managing Director
DIN: 00023582

Date: 10/11/2023
Place: Ahmedabad

Sr. No.	Particulars	Three Months Ended	Three Months Ended	Half Year Ended	Year Ended	
		30-09-2023	30-06-2023	30-09-2022	30-09-2022	31-03-2023
		(Reviewed)	(Reviewed)	(Reviewed)	(Reviewed)	
1	Total Income from Operations (net)	28,942.53	8,858.53	181.80	29,124.33	9,312.08
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional Items)	28,887.90	8,806.64	152.27	29,040.18	9,106.87
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional Items)	28,887.90	8,806.64	152.27	29,040.18	9,106.87
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional Items)	25,547.41	7,932.39	138.35	25,685.77	7,959.48
5	Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	25,547.34	7,932.31	138.31	25,685.66	7,959.47
6	Paid up Share Capital	1,04,276.91	1,04,276.91	1,04,276.91	1,04,276.91	1,04,276.91
7	Reserves (including Revaluation Reserve as shown in the Balance Sheet) as on 31.03.2023	-	-	-	-	67,093.56
8	Security Premium Account	-	-	-	-	-
9	Networth	1,97,056.15	1,76,427.38	1,71,508.79	1,97,056.15	1,71,370.47
10	Paid up Debt Capital / Outstanding Debt	3,36,000.00	4,38,500.00	3,36,000.00	3,36,000.00	3,36,000.00
11	Outstanding Redeemable Preference Shares	-	-	-	-	-
12	Capital Redemption Reserve	5,200.00	5,200.00	5,200.00	5,200.00	5,200.00
13	Debt Equity Ratio	1.71	2.49	1.96	1.71	2.49
14	Debture Redemption Reserve	-	-	-	-	-
15	Debt Service Coverage Ratio	N.A.	N.A.	N.A.	N.A.	N.A.
16	Interest Service Coverage Ratio	N.A.	N.A.	N.A.	N.A.	N.A.
17	Earning per share of Rs. 10/- each					
	Basic (in Rs.)	2.45	0.76	0.01	2.46	0.78
	Diluted (in Rs.)	2.45	0.76	0.01	2.46	0.78

Notes: 1. The above is an extract of the detailed format of quarter and half year ended financial results filed with the Stock Exchanges under Regulation 52 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. These financial results were reviewed by the Audit Committee, and were approved by the Board of Directors, in their respective meetings held on November 10, 2023. This financial statement for the quarter and six months ended has been reviewed by the Statutory Auditors of the company and has issued unmodified limited review report on the same.
2. The above results have been prepared in accordance with recognition and measurement principles laid down Indian Accounting Standards ("Ind AS") - 34 Interim Financial Reporting, notified under Section 133 of the Companies Act, 2013, read together with the Companies (Indian Accounting Standards) Rules, 2015, as amended from time to time, and other accounting principles generally accepted in India.
3. The above Unaudited Standalone Financial Results for the quarter and six months ended on September 30, 2023 are available on the website of NSE Limited (www.nseindia.com) and website of the company (www.gujstl.in).
4. Previous Period's Year's figures have been regrouped and reclassified, wherever necessary.

For and on behalf of Board of Directors
Gujarat State Investments Limited
Director
DIN: 07943985

Place: Gandhinagar
Date : November 10, 2023

Sr. No.	Particulars	Quarter ended	Quarter ended	Half Year ended
		30.09.2023	30.09.2022	30.09.2023
		Unaudited	Unaudited	Unaudited
1	Total Income From Operations (net)	0.00	0.00	0.00
2	Net Profit/(Loss) for ordinary activities (before Tax, Exceptional and/or Extraordinary Items)	(4.09)	(0.24)	(4.62)
3	Net Profit/(Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	(4.09)	(0.24)	(4.62)
4	Net Profit/(Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	(4.09)	(0.24)	(4.62)
5	Total Comprehensive Income for the Period (Comprising Profit/(Loss) for the period (After Tax) and Other Comprehensive Income (After Tax))	(4.09)	(0.24)	(4.62)
6	Equity Share Capital, (face value of Rs.10 each)	1000.00	1000.00	1000.00
7	Reserves (excluding Revaluation Reserve) as shown in balance Sheet of previous year	-	-	-
8	Earning Per Share (of Rs.10/- each) (For continuing and discontinued operations)			
	Basic	(0.041)	(0.002)	(0.046)
	Diluted	(0.041)	(0.002)	(0.046)

Note: 1. The above is an extract of the detailed Unaudited Financial Results ("Results") filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015. The full Financial Results are available on website of Stock Exchanges (i.e. www.bseindia.com) and website of the Company (i.e. www.mangalyasofttech.in).
2. The above results were reviewed by the Audit Committee and thereafter approved by the Board of Directors at their meeting held on November 10, 2023.

For, Mangalya Soft-Tech Limited
Ajay Janyantil Shah
Chairman & Managing Director
DIN: 00023582

Date: 10/11/2023
Place: Ahmedabad

Sr. No.	
---------	--